



SHAH FOODS LIMITED

Corporate Office :

"SARAYU"

16/1, Kalyan Society,

Near Nagri Hospital, Mithakhali,

Ellisbridge, Ahmedabad-380 006. INDIA

Telefax : 91-79-26420273

91-79-26448371

Mobile : 91-99040 03700

E-mail : shahfoods.ahmedabad@gmail.com

CIN - L15419GJ1982PLC005071

Date : 13-08-2021

Dear Sir,

REF: FINANCIAL RESULT FOR THE QUARTER ENDED JUNE 30, 2021

SUB: SUBMISSION OF COPIES OF NEWSPAPER ADVERTISEMENT PURSUANT TO REGULATION 47 OF THE SEBI (LODR) REGULATIONS, 2015

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of financial results of the Company for the quarter ended June 30, 2021 published in the following newspapers on 12-08-2021.

1. The newslines (Gujarati)
2. Chanakya ni Pothi (English)

Kindly take it on your record.

Thanking you,

Yours Faithfully,

For, Shah Foods Limited

Pradip R. Shah

CFO



શ્રી રજુલા ધન

વર્ષ : ૨૭ અંક : ૨૯૨ તા.૧૨-૦૮-૨૦૨૧ પાનાં ૪ માલિક : જયની પબ્લીશિસ નંબી : રણદેવ એન. શાહ સહ તંત્રી : રાધિકા ગેજવાલા

હવે ગણતરીના દિવસોમાં જ ૫૫૦૦૦નું લેવલ

જ્યા અકબીયાથી ભારતીય ભજનના સે-ટીએનમાં નોંધાયર સુધારે છેવટા છે. છેલ્લા લગભગ દશી ૮ અઠવાડિયા દરમ્યાન ભારતીય ભજન નજીક લગભગ ફરમાવું હતું અને તેને કારણે સોન્ટેમ નેનાવાથી કામ કરતા ઈન્ડિયાને અને બીટીએસડીના પેલાઈનો માટે કામ કરવા કોઈ જ નહોતો પોલાઈનો રહ્યો અને જોખમ યાત્રિયા થઈ ગયા હતા પરંતુ ગયા અઠવાડિયા દરમ્યાન મંગલવાણી ભારતીય ભજનના સે-ટીએનમાં નોંધાયર સુધારો લેવાયો છે અને તે પછી હવે અંગ્રેજ મહિના દરમ્યાન તહેવારની યોજના વખતે ભારતીય શેરબજારમાં પણ તહેવારની માહોલ જોવાયે તે આજ બંધાઈ છે



તહેવારની યોજના વખતે ભારતીય શેરબજારમાં પણ તહેવારની માહોલ જોવાયે તે આજ બંધાઈ છે

તે પછી જૂન ક્યારે દરમ્યાન કુટ વધું હોવાની તેની પાછળ કારણ અને કોઈપણ પ્રકારના પર્યાયો ઈલાખો આવ્યો છે અને તેવાની અંતે સિમેન્ટ કંપનીઓની નફાકારક કમાઈ છે પરંતુ મીઠાક તરફ



સે-સોમાં એક તરફ તે તે પછી ૧૫૦૦૦નું લેવલ પસાર થઈ ગયું અને તે પછી હવે ગણતરીના દિવસોમાં જ ૫૫૦૦૦નું લેવલ પસાર થઈ ગયું અને તે સંભાવના મુજબ છે.

આ વખતે અસરના આઈડી સેક્ટરમાં આજની સાલની સરખાવે શેરોમાં વધુ વળ છે. આંદોલનને બે મહિના પહેલાં મોટી તેજી જોવાઈ ગઈ અને તે પછી થયેર શેરોમાં આંદોલન થયું છે.

મોન્ટમાં સે-ટીએન મજબૂત થયું છે. જાણ સિવાયના એશિયા પેસિફિક શેરબજારોમાં ૦.૭૨ ટકાનો વધારો થયો છે.

ભારતીય રિટર્ન બેંક દ્વારા વ્યાજદર અને પોતાની પોલિસીમાં કોઈ જ ફેરફાર નથી કર્યો અને તેને કારણે પણ સે-ટીએન મજબૂત થયું છે. કુદરતે રિટર્ન બેંકની પોલિસીમાં સુધારો કરી અને તેમાં વ્યાજદર અને સિલિટ પ્રધાન રાખવાનો નિર્ણય લેવાયો છે.

સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય ભજનની માહોલ જોવાયે તે આજ બંધાઈ છે. આજની સાલની સરખાવે શેરોમાં વધુ વળ છે. આંદોલનને બે મહિના પહેલાં મોટી તેજી જોવાઈ ગઈ અને તે પછી થયેર શેરોમાં આંદોલન થયું છે.

તેમ છતાં સે-ટીએન મજબૂત થયું છે. જાણ સિવાયના એશિયા પેસિફિક શેરબજારોમાં ૦.૭૨ ટકાનો વધારો થયો છે.

ભારતીય રિટર્ન બેંક દ્વારા વ્યાજદર અને પોતાની પોલિસીમાં કોઈ જ ફેરફાર નથી કર્યો અને તેને કારણે પણ સે-ટીએન મજબૂત થયું છે. કુદરતે રિટર્ન બેંકની પોલિસીમાં સુધારો કરી અને તેમાં વ્યાજદર અને સિલિટ પ્રધાન રાખવાનો નિર્ણય લેવાયો છે.

સિમેન્ટની માંગ વધી જવા કંપનીઓના નવા અકબીયામાં આવવાના છે અને તે આંકડા પણ એક્ટર પોલિસીવ રહે તે સંભાવના મજબૂત છે.

એપ તો મોટા ભાગની સિમેન્ટ કંપનીઓના શેરના ભાવ ખૂબ જ ઝડપથી વધી ગયા હતાં છતાં હજી એક્ટરમાં રિટર્નની જગ્યા પાટી છે અને તેથી સિમેન્ટ શેરો ઉપર ફોક્સ રાખી શકાય.

કે-ટ્રેડિંગમાં કેવી રીતે કમાવાય ?

જુલ જ એકા પુલિટીવિભાગી સારું કમાવું હોવા માટે શેરબજારમાં પ્રવેશવા પછી કોઈપણ સારું અને કે-ટ્રેડિંગમાં ફોલો કરીને તેને વધુ કમાવું અને કમાવે તેમાં કોઈપણ ભૂલો નહીં અને કોઈપણ ભૂલ થયે તેમાં જોઈને કમાવવું છે. અને સમાજ હતા છે. અને સમાજ હતા છે. અને સમાજ હતા છે.

શેરબજારનું ટેકનિકલ એનાલિસિસ સમજો

આ પુસ્તક સમજાવે છે કે શેરબજારમાં કોઈપણ સારું અને કે-ટ્રેડિંગમાં ફોલો કરીને તેને વધુ કમાવું અને કમાવે તેમાં કોઈપણ ભૂલો નહીં અને કોઈપણ ભૂલ થયે તેમાં જોઈને કમાવવું છે. અને સમાજ હતા છે. અને સમાજ હતા છે.

ઇ-ઇલેક્ટ્રિકલ ઇન્વેસ્ટર

આ પુસ્તક સમજાવે છે કે શેરબજારમાં કોઈપણ સારું અને કે-ટ્રેડિંગમાં ફોલો કરીને તેને વધુ કમાવું અને કમાવે તેમાં કોઈપણ ભૂલો નહીં અને કોઈપણ ભૂલ થયે તેમાં જોઈને કમાવવું છે. અને સમાજ હતા છે. અને સમાજ હતા છે.

SHAH FOODS LIMITED

Regd. Office : Kalol-Mehsana Highway, Post-Chhatrat, Tal. Kalol, Dist-Gandhinagar - 382729 e-mail: niran.shah@shahfoods.com

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30th JUNE, 2021

Sr. No.	PARTICULARS	Rupees in Lakhs			
		Quarter ended 30.06.2021	Quarter ended 31.03.2021	Quarter ended 30.06.2020	Quarter ended 31.03.2021
1	Total Income from Operations	0.01	8.78	0.85	10.16
2	Net Profit/(Loss) for ordinary activities before Tax, Exceptional and/or Extraordinary Items	(7.09)	(13.13)	(9.30)	(55.16)
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(7.09)	(13.13)	(9.30)	(55.16)
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(7.09)	(14.74)	(7.61)	(55.28)
5	Total Comprehensive Income for the Period (After Tax and Other Comprehensive Income (After Tax))	(7.09)	(14.74)	(7.61)	(55.28)
6	Equity Share Capital, face value of Rs. 10 each	(7.09)	(14.74)	(7.61)	(55.28)
7	Reserves (excluding Revaluation Reserve) as shown in Balance Sheet of Previous	59.75	59.75	59.75	59.75
8	Earning Per Share (before extraordinary items) (of Rs. 10/- each)	(1.19)	(2.47)	(1.31)	(9.25)
9	Earning Per Share (after extraordinary items) (of Rs. 10/- each)	(1.19)	(2.47)	(1.31)	(9.25)
	Basic	(1.19)	(2.47)	(1.31)	(9.25)
	Diluted	(1.19)	(2.47)	(1.31)	(9.25)

Notes:

- The above results were reviewed by the Audit Committee and taken on record by Board of Directors of the Company at its meeting on 10/08/2021. The above results have been taken by the statutory auditors of the Company.
- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website (www.sebiindia.com) and on the Company website (www.shahfoods.com).
- The financial results of the Company for the quarter ended 30th June, 2021 is prepared in compliance with Ind-AS and have been subjected to limited review by the Statutory Auditors of the Company. The comparative figures for the corresponding quarter ended 30th June, 2021 have been restated to conform to current period in accordance with Ind-AS.
- Exceptional and/or Extraordinary Items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules.

REDEX PROTECH LIMITED

Corporate Office : Parshwanath Business Park, Near Prabhakar Nagar Garden, Satellite, Ahmedabad. PH: 079-2554980, 26587009

EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30.06.2021

Sr. No	PARTICULARS	(Rs. in Lacs)		
		Quarter ended on 30th June 2021	For the year ended on 31st March 2021	Corresponding Quarter Ended on 30th June 2020
1	Total income from operations	644.65	26.93	2.67
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	625.10	-3.74	-3.76
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	625.10	-3.74	-3.76
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	541.61	-6.08	-6.22
5	Total Comprehensive Income for the period (Comprising Profit/Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)	541.61	-6.08	-6.22
6	Equity Share Capital	672.12	672.12	672.12
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year	(-128.24)		
8	Earning Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	8.06	-0.09	-0.09
	Basic	8.06	-0.09	-0.09
	Diluted	8.06	-0.09	-0.09

Notes:

- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full format of the financial Results are available on the Stock Exchange website (www.sebiindia.com) and on the Company website (www.redechprotech.com).
- The result of the Quarter ended on 30th June, 2021 was reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 11th August, 2021.

By Order of the Board of Directors
For, Redex Protech Limited
SD/-
Mr. Ganesh Bhagat
Managing Director
DIN - 09115076

Place : Ahmedabad
Date : 11/08/2021

ડ્રાઇવર ?

ડ્રાઇવર, રલોલા, નોનર ઓલિવ ઓલિવ પૂર્ણ ૪ સરકારી staffavailable.com

ના એક્ટમ કલેબ મહાસ્ત્રના નાને દેખામાં એકમાત્ર ઝાંટી સલામત નોનર કરવામાં ઓલિવ ઓલિવ ટમ્પોરી રજિસ્ટ્રેશન મુજબ છે

તદ્દીન ફ્રી
staffavailable.com

અભ્યાસે ૩. ૧૩૮૨૦૧૫૫ આ સેરમાં ભલે લોટમાં નજીકની તેમજ ઓલિવ, પરંતુ હજી એક કે બે અકબીયાના આ ટાકા પછી વિસ્વાસ કોષ્ટકોમાં ગેર ખૂબ જ સુધારે અભ્યાસે આમાં રહેતો અને તેથી હવે અકબીયા પછાતના તબક્કામાં થોડા થોડા સુધારો નેવા કારણે જાણવા અને તે રીતે તેથી પાવર નીચી આવી શકશે. હવે અકબીયા ઘેરે ત્રણ અકબીયા પછાત પછી આ સેરમાં નવી લેવલ દેખાય છે.

સામે પછી સી.કે. (વિસ્વાસ ગ્રુપની ઓરો) યોજનામાં ગેર અભ્યાસે ૩. ૧૩૮૨૦૧૫૫ આ સેરમાં ભલે લોટમાં નજીકની તેમજ ઓલિવ, પરંતુ હજી એક કે બે અકબીયાના આ ટાકા પછી વિસ્વાસ કોષ્ટકોમાં ગેર ખૂબ જ સુધારે અભ્યાસે આમાં રહેતો અને તેથી હવે અકબીયા પછાતના તબક્કામાં થોડા થોડા સુધારો નેવા કારણે જાણવા અને તે રીતે તેથી પાવર નીચી આવી શકશે. હવે અકબીયા ઘેરે ત્રણ અકબીયા પછાત પછી આ સેરમાં નવી લેવલ દેખાય છે.

સામે પછી સી.કે. (વિસ્વાસ ગ્રુપની ઓરો) યોજનામાં ગેર અભ્યાસે ૩. ૧૩૮૨૦૧૫૫ આ સેરમાં ભલે લોટમાં નજીકની તેમજ ઓલિવ, પરંતુ હજી એક કે બે અકબીયાના આ ટાકા પછી વિસ્વાસ કોષ્ટકોમાં ગેર ખૂબ જ સુધારે અભ્યાસે આમાં રહેતો અને તેથી હવે અકબીયા પછાતના તબક્કામાં થોડા થોડા સુધારો નેવા કારણે જાણવા અને તે રીતે તેથી પાવર નીચી આવી શકશે. હવે અકબીયા ઘેરે ત્રણ અકબીયા પછાત પછી આ સેરમાં નવી લેવલ દેખાય છે.

સામે પછી સી.કે. (વિસ્વાસ ગ્રુપની ઓરો) યોજનામાં ગેર અભ્યાસે ૩. ૧૩૮૨૦૧૫૫ આ સેરમાં ભલે લોટમાં નજીકની તેમજ ઓલિવ, પરંતુ હજી એક કે બે અકબીયાના આ ટાકા પછી વિસ્વાસ કોષ્ટકોમાં ગેર ખૂબ જ સુધારે અભ્યાસે આમાં રહેતો અને તેથી હવે અકબીયા પછાતના તબક્કામાં થોડા થોડા સુધારો નેવા કારણે જાણવા અને તે રીતે તેથી પાવર નીચી આવી શકશે. હવે અકબીયા ઘેરે ત્રણ અકબીયા પછાત પછી આ સેરમાં નવી લેવલ દેખાય છે.

ગામની ગણતરી

૩. ૧૩૪૪૫૫ (ભાવે મૂલી રહ્યો છે. આવા થોડા દિવસોમાં ૩. ૧૫૪૫૫૫ ભવાની સંભાવના મજબૂત, મોટું પ્રોફિટ લુભિત કરીને મોટા થોડા શેરો મજબૂત, તેમાં મજબૂત તેજ માટે સહાય થઈ પડશે. ૩. ૧૨૪૫૫૫ થોડા દિવસો પહેલાં ૩. ૧૨૪૫૫૫ આસપાસ આવી ગયો હતો ભાવે ૩. ૧૪૪૫૫૫ ભવાની ભાવ કંઈ હતી, અભ્યાસે

૩. ૧૩૪૪૫૫ (ભાવે મૂલી રહ્યો છે. આવા થોડા દિવસોમાં ૩. ૧૫૪૫૫૫ ભવાની સંભાવના મજબૂત, મોટું પ્રોફિટ લુભિત કરીને મોટા થોડા શેરો મજબૂત, તેમાં મજબૂત તેજ માટે સહાય થઈ પડશે. ૩. ૧૨૪૫૫૫ થોડા દિવસો પહેલાં ૩. ૧૨૪૫૫૫ આસપાસ આવી ગયો હતો ભાવે ૩. ૧૪૪૫૫૫ ભવાની ભાવ કંઈ હતી, અભ્યાસે

૩. ૧૩૪૪૫૫ (ભાવે મૂલી રહ્યો છે. આવા થોડા દિવસોમાં ૩. ૧૫૪૫૫૫ ભવાની સંભાવના મજબૂત, મોટું પ્રોફિટ લુભિત કરીને મોટા થોડા શેરો મજબૂત, તેમાં મજબૂત તેજ માટે સહાય થઈ પડશે. ૩. ૧૨૪૫૫૫ થોડા દિવસો પહેલાં ૩. ૧૨૪૫૫૫ આસપાસ આવી ગયો હતો ભાવે ૩. ૧૪૪૫૫૫ ભવાની ભાવ કંઈ હતી, અભ્યાસે

૩. ૧૩૪૪૫૫ (ભાવે મૂલી રહ્યો છે. આવા થોડા દિવસોમાં ૩. ૧૫૪૫૫૫ ભવાની સંભાવના મજબૂત, મોટું પ્રોફિટ લુભિત કરીને મોટા થોડા શેરો મજબૂત, તેમાં મજબૂત તેજ માટે સહાય થઈ પડશે. ૩. ૧૨૪૫૫૫ થોડા દિવસો પહેલાં ૩. ૧૨૪૫૫૫ આસપાસ આવી ગયો હતો ભાવે ૩. ૧૪૪૫૫૫ ભવાની ભાવ કંઈ હતી, અભ્યાસે

Vedanta to invest \$20 bn across businesses, double silver and steel output

With a robust outlook for mineral-led growth in India, Anil Agarwal-led Vedanta Limited is looking to invest up to \$20 billion across its businesses, which includes doubling of silver production and steel capacities.

In a virtual press conference held last month, Agarwal said the company planned a capex of \$5 billion over a period of three years. The company has not given a timeline for \$20-billion investment. "In aluminium, we are already India's largest producer. For silver, we aim to double our production, as it is not only a precious metal but also used in high-tech industry and renewable energy. In steel, we intend to double our capacity," Anil Agarwal, founder and chairman of Vedanta Resources Limited, said on Tuesday.

With regard to oil demand, Vedanta is looking to increase domestic production in oil and gas by up to 50 per cent to meet this demand.

The company reported highest-ever earnings before interest, taxes, depreciation and amortisation (EBITDA) of Rs 27,341 crore, up 30 per cent year-on-year.

Revenue of the company for FY2021 was at Rs 86,863 crore, up 4 per cent year on year.

According to a International Finance Corporation (IFC) report, Vedanta's operations contribute 1 per cent to India's

Overall from the sector perspective, mining contributes 1.5 per cent to GDP while metals contribute an additional 2 per cent.

"The GDP contribution of mining and metals must double, possibly even triple. It is the only way to avoid import dependency of the kind we have seen in crude oil," said Agarwal.

Vedanta is also of the view that both technology and digitization are becoming the heart of each of its businesses. The company has implemented industry first digital smelters at one of its plants in Jharsuguda, Odisha. Also, Hindustan Zinc has developed technologies to efficiently manage operations remotely. Of this, about \$2 billion has been earmarked for gas business and the balance for aluminium, copper, steel and zinc where about \$500 million each (at least) would be used as capex.

Sebi examines Ant Group and Alibaba holdings in IPO-bound Paytm

Capital markets regulator Securities and Exchange Board of India (Sebi) is examining if Paytm shareholders Ant group and Alibaba—Hangzhou-headquartered Chinese conglomerates—are in compliance with listing regulations. Ahead of Paytm's public debut, Sebi is looking at whether the two investors must be treated as separate companies or a combined entity. This is part of its due diligence process.

Ant Group, with around 30 per cent stake in Paytm, is the single largest shareholder in the fintech company headed for an initial public offering (IPO).

Ant and Alibaba together hold about 37 per cent in Paytm. Ant is an affiliate of the Alibaba group and are registered as separate companies.

To become a professionally managed company, no single entity can own more than 25 per cent in Paytm.

*Sebi (Issue of Capital and Disclosure Requirements) rules

provide for companies without promoter, also called professionally managed company, where they do not need to designate a promoter. But each issuance has different dynamics. So in this case, Alibaba and Ant group, both are being looked at for compliance issues," said a regulatory source.

If the market regulator views the two as a combined entity, it may impose some caveats and give a definite time frame to offload their stake to 25 per cent from the current 37 per cent. Paytm has already said that Ant group would shed its stake by 5 per cent as part of the IPO to comply with Sebi's PMS norms.

The firm has also opted for declassification of Paytm founder and CEO Vijay Shekhar Sharma as a promoter.

In July, Paytm's parent firm One97 Communications had filed draft documents for an initial public offering (IPO) to raise Rs 16,600 crore, surpassing Coal India's Rs

Coal India net profit jumps 52% in June quarter; expenses rise, too

State-owned Coal India (CIL) on Tuesday reported a 52.4 per cent rise in consolidated net profit at Rs 3,169.85 crore for the quarter ended on June 30, 2021, on the back of higher revenue from operations. The company had posted a consolidated net profit of Rs 2,079.60 crore in the year-to-date period, Coal India said in a filing to BSE.



The consolidated revenue from operations increased to Rs 25,282.15 crore in the April-June period over Rs 18,486.77 crore in the year-to-date period, the filing said. However, the consolidated expenses of the company during the quarter increased to Rs 21,626.48 crore over Rs 16,470.64 crore in the year-to-date period, the filing said.

The coal production of the PSU during the quarter ending June increased to 123.98 million tonnes over 121.04 MT in the quarter ended on June 30, 2020. The offtake of raw coal during the quarter ended June 30, 2021 went up to 160.44 MT over 120.80 MT in the year-to-date period.

A Swiggy IPO could provide good returns, says SoftBank's Masayoshi Son

Zomato's stellar listing and a strong performance on the Indian bourses has given Swiggy's founder Masayoshi Son confidence that Swiggy will be able to deliver 'good returns' if it goes for listing.

"If they go public, I believe that we will be able to see good returns from here too. That's our expectation," said Son on Tuesday in post earnings call with analysts.

Last month, Swiggy closed a \$1.25-billion fundraising, marking the first investment in the category by SoftBank Vision Fund 2. This took the valuation of the Bengaluru-based startup up by more than 50 per cent to \$5.5 billion from \$3.6 billion earlier, according to industry sources. SoftBank has invested around \$360 million to \$450 million in this round into Swiggy (JFY).

Other than prospects of Swiggy's listing the Japanese investment firm is also hopeful of the listing of payments company Paytm and Policybazaar.

A Reuters story quoted Navneet Govil, CFO, Vision Fund on the upside they see in the listing of these two companies. "Further upside will come from listings by Indian payments firm Paytm and insurance aggregator Policybazaar as well as southeast Asian ridehailer Grab, which is due to go public via a blank-check company merger," said Govil to Reuters.

From the funds perspective Son also said that Artificial Intelligence (AI) is the next big bet and SoftBank has next 10 per cent capital raised by unlisted AI companies worldwide. From the Vision Fund 2, it has invested in 91 companies with AI capabilities with a total acquisition cost of \$19.5 billion.

Son further stated that Swiggy has 120,000 partner

Vodafone Idea files review petition in apex court on AGR dues

Debit-laden Vodafone Idea (Vi), which is struggling for survival, moved the Supreme Court on Tuesday, seeking a review of its July 23 order that dismissed the petition that sought the return of telecom firms for a re-computation of adjusted gross revenue (AGR) dues. Airtel, too, is likely to move the court for relief, sources said.

The appeal has been filed even as the telecom department is considering measures to provide financial relief for the sector. Vi did not respond to an email query on the matter. With an accumulated debt of about Rs 1.8 trillion, Vi is likely to be the most adversely hit by the Supreme Court verdict.

Vi had calculated its remaining AGR dues at around Rs 21,500 crore after making a payment of Rs 7,800 crore. However, the telecom department (DoT) arrived at around Rs 58,000 crore as the total AGR liability for the firm.

During the hearing, senior counsel Mukul Rohatgi, who appeared for Vi, had argued that the AGR figures were not cast in stone and that the Supreme Court had powers to correct the "arithmetic error".

The AGR calculation row surfaced after the Supreme Court on September 1, 2020, allowed telecom companies to pay their AGR dues to the

government in instalments spread over a 10-year period, beginning with an upfront payment of 10 per cent of the total. The payment timeline started from April 1, 2021.

Last week, Kumar Mangalam Birla stepped down as non-executive chairman of Vi after offering to give up his stake in the telecom company. Himanshu Kapania, a telecom industry veteran and a nominee of Aditya Birla Group on the board, will take over the chairman's post.

In his letter written on June 7, Birla said he was willing to offer his stake to any government or domestic financial entity to keep Vi afloat.

making us confident about getting to the next billion much sooner," the senior executives said.

The gross order value (GOV), which the company defines as the total monetary value of all food delivery orders placed online on its platform in India, including taxes, customer delivery charges, gross of all discounts, excluding tips, also rose.

The India food delivery business of Zomato reported the highest-over GOV, number of orders, transacting users, active restaurant partners, and active delivery partners, said Goval.

India food delivery GOV in Q1FY22 grew 37 per cent quarter-on-quarter to Rs 4,540 crore (\$605 million), from Rs 3,310 crore (\$442 million) in Q4FY21. It was Rs 1,090 crore (\$145 million) in the year-ago quarter. The company considered an exchange rate of \$1 equalling Rs 75. In the blogpost, the two executives further said the firm has taken steps to improve the working conditions of its delivery partner network after an independent survey last year ranked Zomato at the bottom of a gig worker survey.

Zomato Q1 net loss widens to Rs 356 crore; revenue rises to Rs 844 crore

In its first quarterly results after its listing last month, food delivery platform Zomato said its net loss widened in the first quarter (Q1) ended June 30 due to increased expenses and a hit on dining out as the second wave of the Covid-19 pandemic upended lives and livelihoods.

Zomato also crossed one billion overall orders on the platform last week.

The total loss attributable to equity shareholders rose to Rs 356 crore, from Rs 99.8 crore a year ago. Adjusted earnings before interest, tax, depreciation, and amortisation (EBITDA) loss widened nearly 42 per cent to Rs 170 crore on a quarterly basis.

Revenue from operations in Q1 rose to Rs 844.40 crore, from Rs 266 crore a year ago.

Chief Executive Officer and Co-Founder Deepinder Goyal and Chief Financial Officer Akshant Goyal in a blogpost filed to the BSE and on the company's website said the reported loss in Q1 was "largely on account of non-cash employee stock option plan (ESOP) expenses, which have increased meaningfully in Q1 of 2021-22 (FY22) due to

significant ESOP grants made in the quarter pursuant to creation of a new ESOP 2021 scheme. This divergence in reported profit/loss and adjusted EBITDA will continue, and going forward".

They said Zomato will do earnings/analyst calls once a year, at the end of each financial year, where the firm will share a more detailed commentary on the year gone by, along with key metrics.

Further, Zomato crossed the milestone of delivering one billion orders on Zomato.

"It took us six years to get to this milestone and we hope it takes us much less time to deliver the next billion. The fact that over 10 per cent of these billion orders were delivered only in the last three months

SHAH FOODS LIMITED

Regd. Office : Kaloi-Mehsanah Highway, Post-Chhatral, Tal. : Kaloi, Dist- Gandhinagar - 382729 e-mail: nirav.shah@shahfoods.com. CIN: L15490JH922PLC005071, Website: www.shahfoods.com

Sr. No.	PARTICULARS	Rupees in Lakhs			
		Quarter ended 30.06.2021	Quarter ended 31.03.2021	Quarter ended 30.06.2020	Year ended 31.03.2021
1	Total Income From Operations (net)	0.01	6.70	0.85	10.18
2	Net Profit/(Loss) for ordinary activities before Tax, Exceptional and/or Extraordinary items#	(7.09)	(13.13)	(9.30)	(65.16)
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)#	(7.09)	(13.13)	(9.30)	(65.16)
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)#	(7.09)	(14.74)	(7.81)	(65.28)
5	Total Comprehensive Income for the Period (Comprising Profit/Loss for the period (After Tax) and Other Comprehensive Income (After Tax))	(7.09)	(14.74)	(7.81)	(65.28)
6	Equity Share Capital, (face value of Rs.10 each)	59.75	59.75	59.75	59.75
7	Reserves (excluding Revaluation Reserve) as shown in balance Sheet of previous year				
8	Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/- each)				
	Basic	(1.19)	(2.47)	(1.31)	(9.25)
	Diluted	(1.19)	(2.47)	(1.31)	(9.25)
9	Earnings Per Share (after extraordinary items) (of Rs. 10/- each)				
	Basic	(1.19)	(2.47)	(1.31)	(9.25)
	Diluted	(1.19)	(2.47)	(1.31)	(9.25)

Notes: 1. The above results were reviewed by the Audit Committee and taken on record by Board of Directors of the Company at its meeting on 10/08/2021. The above results have been reviewed by the statutory auditors of the Company. 2. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Yearly Financial Results are available on the Stock Exchange website www.bseindia.com and on the Company's website www.shahfoods.com 3. The financial results of the Company for the quarter ended 30th June, 2021 is prepared in compliance with Indian Accounting Standards (Ind AS) and have been subjected to limited review by the Statutory Auditors of the Company. The comparative figures for the corresponding quarter ended 30th June, 2021 have been restated to conform to current period in accordance with Ind AS. 4. Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules.

Place : Ahmedabad Date : 16-08-2021 For, Shah Foods Limited Sd/- Nirav J Shah DIN : 01808099 Director

REDEX PROTECH LIMITED

Corporate Office : Parshwanath Business Park, Near Prabhudnagar Garden, Satellite, Ahmedabad PH: 079-26584050, 26557009

Sr. no.	PARTICULARS	(Rs. in Lacs)		
		Quarter ended 30th June, 2021	For the year ended on 31st March, 2021	Comprising 3 Months ended on 30th June 2020
1	Total income from operations	644.65	26.93	2.07
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	625.10	-3.74	-3.78
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	625.10	-3.74	-3.78
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	641.81	-6.08	-6.22
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	641.81	-6.08	-6.22
6	Equity Share Capital	672.12	672.12	672.12
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year (continued operations)		-128.24	
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)			
	Basic	8.06	-0.09	-0.09
	Diluted	8.06	-0.09	-0.09

Notes: 1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full format of the financial results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website (www.redeprotech.com) 2. The result of the Quarter ended on 30th June, 2021 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 17th August, 2021.

Place : Ahmedabad Date : 11/08/2021 By Order of the Board of Directors For, Redex Protech Limited Sd/- Mr. Ganesh Bhagat Managing Director DIN - 0015076